



# Bhakta Kavi Narsinh Mehta University

Govt. Polytechnic Campus, Bhakta Kavi Narsinh Mehta University Road, Khadiya, Junagadh, Gujarat (India)-362 263 Ph.(0)0285-2681400 / Fax : 0285-2681503

Website : <http://www.bknmu.edu.in>

Email : [cebknmu@gmail.com](mailto:cebknmu@gmail.com)

## પરીપત્ર

વિષય : યુ.જી. તેમજ પી.જી./બી.એડ. સેમ. ૨ ની પરીક્ષાના પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાની તારીખમાં વધારો કરવા બાબત.  
સંદર્ભ : અત્રેની યુનિવર્સિટીના પરીપત્ર ક્રમાંક-બીકેએનએમયુ/પરીક્ષા/૬૯૯/૨૦૨૧, તા. ૩૧/૦૩/૨૦૨૧.

આથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર્સ ઇન્ચાર્જશ્રીઓ, સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનોને જણાવવાનું કે સંદર્ભ પત્રથી મે/જુન-૨૦૨૧ માં યોજાનાર યુ.જી. તેમજ પી.જી./બી.એડ. સેમ. ૨ ની પરીક્ષાના પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રીની દંડાત્મક ફી સાથેની છેલ્લી તારીખ-૦૪/૦૫/૨૦૨૧ જાહેર કરવામાં આવેલ હતી.

ઉપરોક્ત વિષયે માનનીય કુલપતિશ્રીની આજ્ઞાનુસાર કોવીડ-૧૯ ની પરિસ્થિતિ તેમજ વિદ્યાર્થી હિતને ધ્યાને લઈ પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રીની તારીખમાં વધારો કરવામાં આવેલ છે તેમજ ઓનલાઇન એન્ટ્રી માટેની નવી તારીખો નીચે મુજબ રહેશે. નિયત સમય-મર્યાદામાં કોલેજ દ્વારા તેમના લોગીન મારફત એન્ટ્રી કરવાની રહેશે જેની સર્વે સંબંધીતોએ નોંધ લેવી.

કોર્સનું નામ	રેગ્યુલર ફી	લેઇટ ફી [રેગ્યુલર ફી + ૫૦૦]	દંડાત્મક ફી [રેગ્યુલર ફી + ૫૦૦ + ૧૫૦૦]
યુ.જી./પી.જી./બી.એડ. સેમ. ૨ (એલએલ.બી. સેમ. ૨ સીવાય તમામ કોર્સ)	તા.૧૫-૦૪-૨૦૨૧ થી તા.૧૪-૦૫-૨૦૨૧	તા.૧૫-૦૫-૨૦૨૧ થી તા.૧૭-૦૫-૨૦૨૧	તા.૧૮-૦૫-૨૦૨૧

## ખાસ નોંધ :

૧. સંદર્ભ પરીપત્ર(જુનો પરીપત્ર) માં દર્શાવવામાં આવેલ તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. જેની તમામ સંબંધીતોએ નોંધ લેવી.
૨. COVID-19 અંગે સરકારશ્રી દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી (ફેસ કવર) તેમજ સામાજિક અંતર જાળવી ઉપરોક્ત કામગીરી કરવાની રહેશે.

  
OSD  
પરીક્ષા વિભાગ

ક્રમાંક - બીકેએનએમયુ/પરીક્ષા/૭૭૫/૨૦૨૧

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડિયા, જુનાગઢ-૩૬૨૨૬૩

તા. ૨૮/૦૪/૨૦૨૧

પ્રતિ,

યુનિવર્સિટી ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર્સ ઇન્ચાર્જશ્રીઓ, સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો તરફ....

નકલ સવિનય રવાના:-

- (૧) માન.કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી
- (૨) આઇ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રસિધ્ધ થવા તેમજ યોગ્ય કાર્યવાહી અર્થે )
- (૩) હિસાબી શાખા.